



PBL-1601250101010100 Seat No. _____

B. A. (Sem. I) (CBCS) (W.E.F. 2016) Examination

November / December - 2018

Economics : Paper - 01

(Principles of Economics - 1) (Core) (New Course)

Time : $2\frac{1}{2}$ Hours]

[Total Marks : 70]

- Sૂચના : (1) બધા જ પ્રશ્નોના ગુણ સરખા છે.
 (2) આંતરિક વિકલ્પના આધારે બધા પ્રશ્નોના જવાબ આપો.

1 અર્થશાસ્ત્ર એટલે શું ? અર્થશાસ્ત્રનું કાર્યક્ષેત્ર સંવિસ્તર સમજાવો. 14

અથવા

1 ઘટતા સીમાન્ત તુષ્ટિગુણનો નિયમ સમજાવો. તેનું મૂલ્યાંકન કરો. 14

2 અર્થશાસ્ત્રના નિયમોનું મહત્વ અને મર્યાદાઓ સ્પષ્ટ કરો. 14

અથવા

2 માંગની મૂલ્યસાપેક્ષતાનો ઝાલ સમજાવો. તેના પ્રકારો ચર્ચા. 14

3 એડમ સ્મિથે આપેલ અર્થશાસ્ત્રની સંપત્તિલક્ષી વ્યાખ્યા સમજાવો. તેની મર્યાદાઓ 14
 જણાવો.

અથવા

3 સમ-સીમાન્ત તુષ્ટિગુણના નિયમ દ્વારા ગ્રાહકની સમતુલ્યાની ચર્ચા કરો. 14

4 પ્રો. આલ્ફેડ ભાર્શલની અર્થશાસ્ત્રની વ્યાખ્યા સમજાવો. 14

અથવા

4 તુષ્ટિગુણ વિશ્લેષણની ધારણાઓ અને મર્યાદાઓ ચર્ચા. 14

5 ટૂંકનોંધ લખો : (ગમે તે બે)
 (1) અર્થશાસ્ત્રનું સ્વરૂપ

(2) માંગની મૂલ્યસાપેક્ષતાને અસર કરતાં પરિબળો

(3) રોબિન્સની અર્થશાસ્ત્રની વ્યાખ્યા

(4) માંગની આવક સાપેક્ષતાના પ્રકારો.

ENGLISH VERSION

- Instructions :** (1) All questions carry equal marks.
(2) Answer all the questions on the basis of internal options.
- 1** What is Economics ? Explain the scope of economics in detail. **14**
- OR**
- 1** Explain the law of diminishing marginal utility. **14**
Evaluate it.
- 2** Specify the importance and limitations of economics law. **14**
- OR**
- 2** Explain the concept of price elasticity of demand. **14**
Discuss its types.
- 3** Explain wealth of economics, given by Adam Smith. **14**
Discuss its limitations.
- OR**
- 3** Explain the consumer equilibrium with the help of law of equal marginal utility. **14**
- 4** Explain the definition of economics, given by Prof. Alfred Marshall. **14**
- OR**
- 4** Discuss the assumptions and limitations of utility analysis. **14**
- 5** Write short notes : (any **two**) **14**
- (1) Nature of Economics
(2) Factors affecting price elasticity of demand
(3) Robin's definition of economics
(4) Types of income elasticity demand.
-